

‘વિદેશમાં નહીં, ભારતમાં જ તમારી મહેનત અને પ્રતિભાને આકાર આપો’

|| ગાંધીનગરમાં પદવીદાન સમારંભમાં L&Tના સીઈઓ કે. વેંકટરામનનું પ્રેરક સંબોધન



નવગુજરાત સમય > અમદાવાદ

‘ઉદ્યોગ, શિક્ષણ, ટેકનોલોજી, ઈનોવેશન, દરેક ક્ષેત્રે આજે ભારત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. આવા સમયે ભલે વિદેશમાં અભ્યાસ કરવા જાવ, પણ અંતે આપણાં દેશમાં જ તમારી મહેનત અને પ્રતિભાને આકાર આપો’, લાર્સન એન્ડ ટુબ્રોના સીઈઓ અને એમડી કે. વેંકટરામનને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) ગાંધીનગરના વિદ્યાર્થીઓને પદવીદાન સમારંભ અવસરે સંબોધ્યાં હતા.

શનિવારે યોજાયેલા આઈઆઈટી ગાંધીનગરના ત્રીજા વાર્ષિક પદવીદાન સમારંભમાં બીટેક, એમટેક અને પીએચડી મળીને, કુલ ૧૬૧ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા કે. વેંકટરામનને આ અવસરે વિદ્યાર્થીઓને ઈમાનદારી અને જવાબદારીઓનું મહત્વ સમજાવવા સાથે દિશામાં આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું, ‘મને આઈઆઈટીમાં મિકેનિકલ એન્જિન્યરિંગ શાખામાં એડમિશન નહોતું મળતું. નિરાશ થયા વગર મેં કેમિકલ

પદવીદાન સમારંભમાં ૧૬૧ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરતા વિદ્યાર્થીઓ ઝૂમી ઊઠ્યા હતા.

એન્જિન્યરિંગમાં અભ્યાસ શરૂ કરી દીધો. તમારી સામે રહેલી તકને ઝડપી લો.’ કે. વેંકટરામનન આઈઆઈટી દિલ્હીના પ્રથમ બેચના વિદ્યાર્થી રહી ચૂકેલાં છે. તેમણે વિદ્યાર્થીઓને તેમના જીવનના કેટલાક અનુભવોની વાત કરતા જણાવ્યું હતું કે કારકિર્દી તરફ આગળ વધતા રૂપિયા કમાવવાનો લોભ ન રાખતા. પેશન અને ઈનોવેશનની સાથે મહેનત કરતા રહેશો તો સફળતા જરૂરથી મળશે.

કે. વેંકટરામનને કહ્યું હતું, ‘આજના યુગમાં સફળતા પ્રાપ્ત કરવા મલ્ટિ-ડિસીપ્લિનરી બનવું જરૂરી છે, એટલે કે દરેક ક્ષેત્રમાં સક્ષમ બનીને જ અન્ય લોકોથી અલગ પડી શકાશે.’ પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધતા આઈઆઈટી ગાંધીનગરના ડિરેક્ટર સુધીર જૈને કહ્યું હતું, ‘તમારી સામે હવે સફળતા પ્રાપ્ત કરવાની અનેક તક અને શસ્ત્રો છે. સમજી વિચારીને તેની પસંદગી કરી ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં તમારો ફાળો આપવા તૈયાર થઈ જાવ.’ આ કાર્યક્રમમાં ૧૨૩ બીટેક, ૩૬ એમટેક અને બે પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ઉપરાંત, અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓની કામગીરીને ધ્યાનમાં રાખતા, તેમને ૩૦ જેટલા મેડલ તથા અન્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.